

B.Com. Semester - 6 (CBCS) Examination
March/April-2024 (NEW COURSE)
Indirect Tax Law-2 (Dse-3 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	GST કાયદા હેઠળ નોંધણી કરાવવા માટે કોણ જવાબદાર છે? નોંધણીની પ્રક્રિયા વિગતવાર સમજાવો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૧	GST નોંધણી રદ કરવાની પ્રક્રિયા વર્ણવો.	(૨૦)
પ્રશ્ન.૨	ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે શું? તેની ગણતરી માટેની પ્રક્રિયા વિગતવાર સમજાવો.	(૨૦)
	અથવા	
પ્રશ્ન.૨	સવિસ્તાર સમજાવો. (A) રિફંડ વાઉચર. (B) બિલ ઓફ સપ્લાય.	(૨૦)
પ્રશ્ન.૩	કસ્ટમ કાયદાનો અર્થ જણાવી તેનો ખ્યાલ સમજાવો તથા પ્રાદેશિક જળક્ષેત્રની સમજૂતી આપો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૩	કસ્ટમ કાયદાની બંધારણીય જોગવાઈઓ જણાવો.	(૧૫)
પ્રશ્ન.૪	નોંધ લખો.	(૧૫)
	(A) એન્ટી ડમ્પિંગ ડ્યુટી. (B) સલામત કસ્ટમ ડ્યુટી.	
	અથવા	
	(A) મૂળભૂત કસ્ટમ ડ્યુટી. (B) વધારાની કસ્ટમ ડ્યુટી.	

ENGLISH VERSION

Que.1	Who are liable to take a registration under GST law? Explain its registration process in detail.	(20)
	OR	
Que.1	Describe the procedure for cancellation of registration under GST.	(20)
Que.2	what is input tax credit? Explain in detail procedure for calculation of its.	(20)
	OR	
Que.2	Explain in detail. (A) Refund voucher. (B) Bill of supply.	(20)
Que.3	Explain meaning and basic concept of custom law and also explain territorial water.	(15)
	OR	
Que.3	Describe the constitutional provisions of custom law.	(15)
Que.4	Write note.	(15)
	(A) Anti-dumping duty. (B) Safeguard custom duty.	
	OR	
	(A) Basic custom duty. (B) Additional custom duty.	
